

## બ્રેમ્પટન સીટી કાઉન્સિલ ડિક્લેર્સ એ હેલ્થ કેર ઇમરજન્સી (બ્રેમ્પટન સીટી કાઉન્સિલે આરોગ્ય સંભાળ કટોકટીની જાહેરાત કરી)

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 22, 2020) – આજે બ્રેમ્પટન સીટી કાઉન્સિલે, કાઉન્સિલમાં બ્રેમ્પટનમાં આરોગ્ય સંભાળ કટોકટીની ઘોષણા કરવા સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કર્યો.

આ પ્રસ્તાવ સીટી કાઉન્સિલર હરકિરત સિંહે (Harkirat Singh) રજૂ કર્યો હતો, અને પ્રસ્તાવ પર મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) અને બધાં કાઉન્સિલરોએ સંમતિ આપી હતી. પ્રસ્તાવનું પરિણામ એ ઠરાવનું આવ્યું કે:

- સીટી ઓફ બ્રેમ્પટન માટે હેલ્થ કેર ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવે; અને
- દર્દીને સુરક્ષિત અને ગુણવત્તાસભર સંભાળ તાત્કાલિક પૂરી પાડવાના હેતુસર બ્રેમ્પટન સિવિક હોસ્પિટલ અને પીલ મેમોરિયલ સેન્ટર કર્મચારીઓની પૂરેપૂરી સંખ્યા અને સંસાધનો સાથે કામ કરે તેવી ખાતરી કરવા તેઓને તાકીદે મોખરાનું ભંડોળ મંજૂર કરવા CAO (ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર) અને યોગ્ય સીટી કર્મચારીગણને વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમ (WOHS), પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયો અને ગવર્નમેન્ટ ઓફ કેનેડા સાથે કામ કરવાની વિનંતી કરવામાં આવે; અને
- ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે કાર્યરત હોવાની ખાતરી કરવા અને હોસ્પિટલમાં વધારાની બેડ્સ સાથે પૂરતી ઈનપેશન્ટ (દાખલ દર્દીઓની) સેવાઓમાં હોસ્પિટલમાં બેડ્સની સંખ્યા વ્યક્તિ દીઠ પ્રોવિન્સિયલ સરેરાશ બરાબર હોવાની ખાતરી કરવા, વધારાની 850 બેડ્સ માટે જરૂરિયાત, એકીકૃત આરોગ્ય અને સુખાકારી માટે પીલ મેમોરિયલ સેન્ટરના તબક્કા II વિકાસમાં પીલ મેમોરિયલ સેન્ટરમાં, પ્રોવિન્સની સરકારના આ વર્તમાન આદેશમાં હાસલ કરવા, CAO અને યોગ્ય સીટી કર્મચારીગણને વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમ (WOHS), પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયો અને ગવર્નમેન્ટ ઓફ કેનેડા સાથે કામ કરવાની વિનંતી કરવામાં આવે; અને
- આ ઠરાવની નકલ આરોગ્ય મંત્રી, પ્રોવિન્સની પાર્લામેન્ટ (પ્રાંતીય સંસદ)ના બ્રેમ્પટનના તમામ સભ્યો, પ્રીમિયર ઓફિસ (પ્રોવિન્સની સરકારના મુખિયાનું કાર્યાલય), પ્રોવિન્સની પાર્લામેન્ટના તમામ ઓપોઝિશન લીડર્સ (વિપક્ષોના આગેવાનો), ફેડરલ પાર્લામેન્ટ (સંઘીય સંસદ)ના બ્રેમ્પટનના તમામ સભ્યો, વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમના પ્રેસિડન્ટ અને CEO, બ્રેમ્પટન/ઈટોબિકો અને એરિયા ઓન્ટેરિયો હેલ્થ ટીમ અને રીજીયન ઓફ પીલ.

ડિસેમ્બરમાં, કાઉન્સિલે એક ઠરાવ પસાર કર્યો જેમાં ભંડોળમાં મુખ્ય તફાવતો, લાંબો પ્રતિક્ષા સમય, અને હોલવેમાં દવા સહિતની, બ્રેમ્પટનની આરોગ્ય સંભાળ સિસ્ટમની અજોડ અને તાકીદી જરૂરિયાતોને ઓળખવામાં આવી. આ ઠરાવમાં આરોગ્ય સંભાળ તંત્ર પૂરું પાડનાર સૌને તાકીદે કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી.

સીટી દ્વારા બ્રેમ્પટનના આરોગ્ય સંભાળ તંત્ર માટે વધુ ભંડોળ અને સહાયતાની વિનંતી કરવા ઘણી પહેલો કરવામાં આવી છે. આમાં ફેડરેશન ઓફ કેનેડિયન મ્યુનિસિપાલિટીસ અને એસોસિએશન ઓફ મ્યુનિસિપાલિટીસ ઓફ ઓન્ટેરિયો માટે વાર્ષિક કોન્ફરન્સીસમાં પ્રોવિન્સના ફેડરલ (સંઘીય) પ્રતિનિધિઓને રજૂઆત કરવાનું, પ્રોવિન્સ અને ફેડરલ સરકારના બંને સ્તરો માટે આગામી અંદાજપત્ર પહેલાંની રજૂઆત પ્રક્રિયા મારફતે સરકારને વકીલાત કરવાનું, અને બ્રેમ્પટનની આરોગ્ય સંભાળ ચિંતાઓ માટે જાગૃકતા અને સહાયતાની હિમાયત કરવા #FairDealForBrampton health care advocacy campaign (બ્રેમ્પટનની આરોગ્ય સંભાળ વકાલત ઝુંબેશ માટે વ્યાજબી આચરણ) પ્રોત્સાહિત કરવાનું સામેલ છે.

આજની તારીખ સુધીમાં, [#FairDealForBrampton campaign](#) ને બ્રેમ્પટન અને અન્ય મ્યુનિસિપાલિટીસ વચ્ચે આરોગ્ય સંભાળ ભંડોળના તફાવતને દૂર કરવાની અરજીમાં, પીલ મેમોરિયલ સેન્ટરમાં સગવડો અને સેવાઓ વિસ્તારવા માટે ભંડોળ અને સહાયતા પૂરી પાડવા, અને બ્રેમ્પટનમાં ત્રીજી આરોગ્ય સંભાળ સગવડ માટે ભંડોળ પૂરું પાડવા 18,000 રહેવાસીઓની સહીઓ મળી છે.

**અવતરણો (ક્વોટ્સ):**

“બ્રેમ્પટનના આરોગ્ય સંભાળ તંત્રને પ્રોવિન્સિયલ સરકાર પાસેથી ભંડોળ અને સહાયતાની સખત જરૂર છે. બ્રેમ્પટન સીટી કાઉન્સિલ વતી, અમે નિષ્ક્રિય બનીને બેસી રહેશું નહીં. અમે બ્રેમ્પટનમાં આરોગ્ય સંભાળ કટોકટીની ઔપચારિક ઘોષણા કરી છે અને અમે આપણાં સમુદાયની તાકીદી જરૂરિયાતોને સંબોધવા આરોગ્ય સંભાળ તંત્ર પૂરું પાડનાર તમામ પાસેથી તાકીદી કાર્યવાહી અને પ્રતિભાવની વિનંતી કરી રહ્યાં છીએ.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

“કેનેડામાં સૌથી ઝડપથી વિકસી રહેલા શહેર તરીકે, બ્રેમ્પટન વ્યાજબી અને પૂરતી આરોગ્ય સંભાળ મેળવવાને પાત્ર છે. દર્દીઓ શહેરની એકમાત્ર હોસ્પિટલના હોલવેમાં મરી રહ્યાં છે. અમારા માટે આરોગ્ય સંભાળ પર વ્યાજબી વ્યવહારની માગણી કરવાનો અને ભીડભાડમાં અને અપૂરતા ભંડોળથી હોલવેમાં દવા આપવાનું બંધ કરાવવાનો સમય આવી ગયો છે. બ્રેમ્પટનને રાહ જોવાનું પોસાઈ શકે તેમ નથી!”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), ચેર, કમ્યુનિટી સર્વિસીસ

“આજે આ પ્રસ્તાવ રજૂ કરવાનું સંપૂર્ણપણે અનિવાર્ય હતું. બ્રેમ્પટનની હોલવે દવા અને ભીડભાડનો સતતપણે ઉપયોગ રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય સંભાળ કટોકટી કેવી જાણાય છે તેનું ઉદાહરણ દર્શાવવા તરીકે થાય છે. બ્રેમ્પટન પોતાનો વ્યાજબી હિસ્સો મેળવવાને હકદાર છે અને આપણાં રહેવાસીઓ પૂરતી આરોગ્ય સંભાળ સુધી પહોંચ મેળવવાના મૂળભૂત અધિકારને પાત્ર છે.”

- હરકિરત સિંહ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક:**

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)